

Essar Shipping Limited
Essar House
11 K. K. Marg
Mahalaxmi
Mumbai - 400 034
India.

Corporate Identity Number :
L61200GJ2010PLC060285

T +91 22 6660 1100
F +91 22 2354 4312
www.essar.com

September 07, 2020

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalai Street, Mumbai - 400 001
Scrip Code: 533704

National Stock Exchange of India Ltd.
Exchange Plaza, Block G,C/1, Bandra Kurla
Complex, Bandra (E), Mumbai - 400 051
Symbol: ESSARSHPNG

Subject: Submission of Newspaper Publication giving prior intimation for the 10th Annual General Meeting (AGM) of the Company- Regulation 30

Dear Sir,

Pursuant to Regulation 30 read with Part C of Schedule III of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, and in compliance with the Circular issued by the Ministry of Corporate Affairs and SEBI, please find enclosed herewith Newspaper Publication published for Shareholders in Jai Hind & Financial Express informing, inter alia, that:

1. The 10th Annual General Meeting ('AGM') of the members of the Company is scheduled to be held on Wednesday, 30th September 2020 at 3:00 PM (IST) through Video Conference ('VC') / Other Audio Visual Means ('OAVM') without physical presence of members at a common venue;
2. The Notice of the 10th AGM and Annual Report for FY2019-2020 will be sent to all the members whose email addresses are registered with the Company/ Depository Participants (DPs) and requesting the members to update their email addresses; and



3. The Company has arranged remote e-voting/e-voting facility for the said AGM.

Kindly take the above on your record.

Thanking You.

Yours faithfully,

For Essar Shipping Limited



Jyotsna Gupta
Company Secretary and Compliance Officer



Encl: As above

Public Notice for Change of Branch Address

This is to bring to the notice of the General Public & Customers of **Fincare Small Finance Bank Ltd.**, that the address of the following branches has been changed. All Accounts/Transactions currently maintained at the branch will remain the same. The details of the old vis-a-vis new address of various locations along with effective date of change is enclosed with notice as Annexure-A. Customers are requested to contact the Branch Manager/visit the New location for their transactions.

For more information Please visit us or Contact Branch Managers of respective Branches. The Contact Numbers of Branch Managers of respective branches are provided in the Annexure-A attached with this notice.

Fincare Small Finance Bank Limited.

"Annexure-A"

No.	Branch	State	Effective Date of Change of Address	Old Address	New Address	Contact No.
1	TARAPUR	GUJ	01.07.2020	Above Manubhai Lakhadwala, Lohkhandwala Complex, Tarapur Cross Road, Tarapur, Dist - Anand, Pin-388180	1st Floor, Maruti Arcade, Tarapur Road, Near Adhar Mall, At & Post-Tarapur, Dist - Anand, Pin-388180	8347399210

ESSAR SHIPPING LIMITED

Registered Office: EBTL, Premises, ER-2 Building (Admin. Building), Salaya 44 Km, P.O. Box No. 7, Taluka Khambhalia, Devbhumi Dwaraka, Gujarat - 361305, India.
Email: esl.secretariat@essarshipping.co.in • Website: www.essar.com
CIN: L61200GJ2010PLCO0285
Head Office: Essar House, 11, K.K. Marg, Malabar, Mumbai - 400034.

NOTICE TO THE MEMBERS OF THE COMPANY REGARDING 10TH ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VC/OAVM

Notice is hereby given that the 10th Annual General Meeting ("AGM") of the members of Essar Shipping Limited ("Company") will be convened on Wednesday, September 30, 2020 at 3:00 p.m. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") & Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 read with General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated April 08, 2020, April 13, 2020 and May 05, 2020 respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular") to transact the business as set forth in the AGM Notice.

Advertisement / Notice

BANK OF BARODA, Regional Office, Navsari Region having its office at 1st Floor, Ramji Mandir Shopping Complex, Dudhjalav, Navsari - 396445, invites offers from the Owners/Power of Attorney Holders of premises on ground floor with the area of 200 to 225 sq. ft. (preferably) for its e-Lobby at Lunsuki, Navsari, with all the facilities including adequate power. The premises shall be ready for occupation likely to be ready for occupation within a period of 1 to 3 months, and located at commercial areas of Lunsuki. The intending offerors shall submit their offers in two separate sealed covers superscribed TECHNICAL BID and PRICE BID to THE REGIONAL MANAGER (AGM), Bank of Baroda, 1st Floor, Shree Ramji Mandir Shopping Complex, Dudhjalav, Navsari - 396445 on or before 28.09.2020. Priority would be given to the premises belonging to Public Sector Units/Govt. Departments.

The bank reserves its right to accept or reject any offer without assigning reasons therefor.

REGIONAL MANAGER (AGM)
Date: 04.09.2020 | Place: NAVSARI | NAVSARI REGION

सेन्ट्रल बँक ऑफ इंडिया
Central Bank of India

M. G. Road Kanpith Branch : Surat-395003.

POSESSION NOTICE

APPENDIX IV [See Rule 8(1)] (For immovable/movable property)

Whereas, The undersigned being the Authorised Officer of Central Bank of India, M.G. Road, Kanpith Surat under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 15.02.2020 calling upon the Borrower 1. Mr. Ashwinbhai Veljibhai Hirpara, Mrs. Manishaben Ashwinbhai Hirpara & Guarantor Mr. Deepakbhai Babubhai Savaliya to repay the amount mentioned in the notice being Rs. 11,57,207/- (Rupees Eleven Lacs Fifty Seven Thousand Two Hundred Seven Only) as on 15.02.2020 + interest and expenses thereon, within 60 days from the date of receipt of the said notice.

The Notice of the 10th AGM along with the Annual Report for the financial year 2019-20 will be sent only by email to all those Members, whose email addresses are registered with the Company or with their respective Depository Participants, in accordance with the MCA Circulars and the SEBI Circular. Members who have not registered their e-mail addresses with the Depositories/Company/Registrar and Share Transfer Agent (RTA), so far, may contact Ms. Jyotsna Gupta, member@essarshipping.co.in or 022 6601100 for registering their e-mail IDs on or before 06.09.2020 for entitling the members to cast their vote. The Company shall send the Notice to such members whose e-mail IDs get registered within the aforesaid time enabling them to participate in the meeting and cast their votes.

Members can participate in the 10th AGM through VC/OAVM only. Necessary arrangements have been made by the Company with National Securities Depository Limited (NSDL) to facilitate e-Voting. The instructions for joining the 10th AGM and the manner of participation in the remote e-voting or casting vote through the e-voting system during the 10th AGM are provided in the Notice of the 10th AGM. Members participating through the VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act. The facility for joining the meeting shall be kept open at least 15 minutes before the time scheduled, and shall not be closed till expiry of 15 minutes after such scheduled time.

सेन्ट्रल बँक ऑफ इंडिया
Central Bank of India

M. G. Road Kanpith Branch : Surat-395003.

POSESSION NOTICE

APPENDIX IV [See Rule 8(1)] (For immovable/movable property)

Whereas, The undersigned being the Authorised Officer of Central Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 20.09.2017 calling upon the Borrower 1. Mrs. Belaben Pravinbhai Patel, Add. - D-1, Ishwernagar, Gotala Wadi, Katargam, Surat & Mr. Fenilkumar Rajeshbhai Patel, Add. - D-1, Ishwernagar, Gotala Wadi, Katargam, Surat & Guarantor Mr. Vijaybhai Bhagvandas Vaishnav, 8 Vandana Society, Pal Road, Adajan, Surat-395009 to repay the amount mentioned in the notice being Rs. 6,47,168/- (Rupees Six Lacs Forty Seven Thousand One Hundred Sixty Eight Only) as on 22.01.2020 + interest and expenses thereon, within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this 1st day of September, 2020.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower/ Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India, M.G. Road, Kanpith, Surat for an amount Rs. 11,57,207/- (Rupees Eleven Lacs Sixty Three Thousand Seven Hundred Seventy Eight Only) as on 15.02.2020 with subsequent interest & expenses thereon, (less if any payments made)

DESCRIPTION OF THE IMMOVABLE/MOVABLE PROPERTY

Equitable Mortgage of Flat No. C-406, Sai Palace Residency, Nr. Sardar Nagar, Opp. Side of Sweet Home & Sweet House, New Kasad Road, Kasad, Surat. Area Admeasuring super built up area 851.00 sq. ft. and Built up area 511.00 sq. ft. i.e. equivalent to 47.49 sq. mtrs. on the 4th Floor, of Building No. "C" of Sai Palace Residency along with undivided proportional share admeasuring 25.34 sq. mtrs. In the land under the said including parking area, constructed on the land bearing final Plot No. 324, T.P. Scheme No. 66 (Kosad-Variyav), Revenue Survey No. 592/5, its Block No. 1069 paiki 1 of moje Village Kosad, City Surat, Taluka City (Choryasi), District : Surat stand in the name Ashwinbhai Veljibhai Hirpara.

The Notice of the 10th AGM along with Annual Report will also be available on the website of the Company i.e. www.essar.com, website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of NSDL at www.evoting.nsdl.com

Notice is also hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday, September 24, 2020 to Wednesday, September 30, 2020 (both days inclusive).

This Notice is being issued for the information and benefit of the Members of the Company in compliance with the MCA Circulars and the SEBI Circular.

For Essar Shipping Limited
Jyotsna Gupta
Company Secretary

Date: September 04, 2020
Place: Mumbai

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this 1st day of September, 2020.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower/ Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India for an amount Rs. 6,47,168/- (Rupees Six Lacs Forty Seven Thousand One Hundred Sixty Eight Only) as on 22.01.2020 with subsequent interest & expenses thereon, (less if any payments made)

HEC INFRA PROJECTS LIMITED

Registered Office: Sigma-1 Corporates, Corporate House No. 6, Sindhu Bhavan Road, Nr. Maan Party Plot Cross Road, Bodakdev, Ahmedabad - 380054, Gujarat. Phone: +91-79-40086771-74
E: elect@hectrack.com, W: www.hectrack.com, CIN: L45200GJ2005PLCO46870

NOTICE TO MEMBERS OF 15th ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 15th Annual General Meeting ("AGM") of the Members of HEC Infra Projects Limited ("the Company") will be held on Tuesday, 29th September, 2020 at 12:00 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") & Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 read with General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated 8th April, 2020, 13th April, 2020 and 5th May, 2020 respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 issued by Securities and Exchange Board of India ("SEBI Circular") to transact the businesses as set forth in the Notice of 15th AGM, without the physical presence of the Members at a common venue.

RIDDHI SIDDHI GLUCO BIOLS LIMITED

CIN: L24110GJ1999PLCO13967

Regd. Office: 10, Ashbreeze Corporate Park, Nr. Swagat Bungalows BRTS Bus stand, Ambli-Bopal Road, Ambli, Ahmedabad, Gujarat - 380058. Phone: 02711-29600-602, email: rshd@riddhisiddhi.co.in, website: www.riddhisiddhi.co.in

NOTICE OF THE 29th ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the 29th Annual General Meeting ("AGM") of the Members of Riddhi Siddhi Gluco Biols Limited ("Company") will be held on Monday, 28th September, 2020 at 11:00 a.m. through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) to transact the business, as set out in the Notice of the 29th AGM. The Company has sent the Annual Report along with Notice convening AGM on Friday, 4th September, 2020, through electronic mode to all the Members whose e-mail IDs are registered with the Company's Registrar & Share Transfer Agent by M/s. Central Depository Services Limited ("CDSL") Depository Participant(s) in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5th May, 2020 read with its circulars dated 8th April, 2020 and 13th April, 2020 and the Securities and Exchange Board of India circular dated 12th May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.riddhisiddhi.co.in, BSE Limited at www.bseindia.com and on the website of CDSL at www.evotingindia.com.

Chartered Capital And Investment Limited

Regd Office: 711, Mahakant, Opp. V/S Hospital, Ellisbridge, Ahmedabad - 380006 (CIN: L452010G1986PLCO05577) Phone: +91-79-2657 5731 Email: info@charteredcapital.net, Website: www.charteredcapital.net

NOTICE OF 34th ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE is hereby given pursuant to provisions of Section 91 of the Companies Act, 2013 & applicable Rules thereunder and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 ("SEBI (LODR) Regulations") that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday, September 24, 2020 to Wednesday, September 30, 2020 (both days inclusive) for the purpose of 34th Annual General Meeting ("AGM") of the company to be held on Wednesday, September 30, 2020 at 11:30 a.m. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM").

In terms of Section 108 of the Companies Act, 2013 read with applicable rules and Regulation 44 of SEBI (LODR) Regulations, the Company is pleased to offer e-voting facility to all its members to enable them to cast their vote electronically using remote e-voting system as well as e-voting on the date of the AGM, on all proposed resolutions set forth in the Notice. For this purpose, the Company has availed the services of National Securities Depository Limited (NSDL). All the members are informed that:

a) Annual Report for FY 2019-20 including Notice of 34th AGM has been sent to all the members whose e-mail ID is registered with Company/Depository Participants ("DP") on their email ID on September 4, 2020. In terms of SEBI Circular dated May 12, 2020 and MCA Circulars dated May 05, 2020, April 13, 2020 and April 20, 2020, the Annual Report for FY 2019-20 along with Notice of the AGM has been sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/DP and holding shares as on the cut-off date for the dispatch. Accordingly, hard copies of the Annual Report will not be sent to any member. Members whose email ID is not registered with the Company/DP, may write to info@charteredcapital.net for obtaining the soft copy of the Annual Report and Notice of AGM.

b) The remote e-voting period will commence on Sunday, September 27, 2020 at 9:00 a.m. and will end on Tuesday, September 29, 2020 at 5:00 p.m. The remote e-voting shall not be allowed beyond 5.00 p.m. on September 29, 2020. The facility for e-voting will be made available at the AGM also and the members attending the meeting through VC who have not already cast their vote by remote e-voting shall be able to exercise their right during the meeting. Detailed instructions including process and manner for e-voting are given in the AGM Notice.

c) Annual Report for FY 2019-20 including Notice of AGM is available on the Company's website www.charteredcapital.net and Notice of the AGM is also available on the NSDL's website www.evoting.nsdl.com.

d) Members are requested to note that a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date (i.e. September 23, 2020) shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting during the AGM.

e) Any person who becomes a member of the company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date (i.e. September 23, 2020), may cast their votes electronically by following the instructions and process of e-voting as provided in the Notice of the AGM.

f) Members are requested to note that a member may attend & participate in the general meeting even after exercising his right to vote through remote e-voting. However he/she shall not be entitled to cast their vote again.

g) In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evotingindia.com. Members who need assistance before or during the AGM, can contact NSDL on their toll free no. 1800-222-990 or send a request at evoting@nsdl.co.in or in contact NSDL officials Mr. Pratik Bhatt at designated email ID: pratikb@nsdl.co.in or at telephone nos.: +91-22-24994738, or Ms. Sarita Mehta at designated email ID: saritam@nsdl.co.in or at telephone nos.: +91-22-24994890. For any sort of query or information including e-voting, the shareholders may also contact Mr. Manoj Kumar Ramkrishny, Company Secretary at the registered office address of the Company or write an email to info@charteredcapital.net or call him at Tel: 079-2657 5377, 2657 7571. Mob: N Khercha

Notice is also hereby given that pursuant to the provisions of section 91 of the Companies Act, 2013, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Monday, 21st September, 2020 to Monday, 28th September, 2020 (both days inclusive) for the purpose of 29th AGM of the Company. Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically through e-voting services provided by the CDSL on all resolutions as set forth in the 29th AGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Monday, 21st September, 2020 (cut-off date). The remote e-voting period commences on Friday, 25th September, 2020 at 9:00 a.m. and will end on Sunday, 27th September, 2020 at 5:00 p.m. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.

The manner of remote e-voting and voting at the AGM by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses is provided in the Notice of the AGM.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date ; may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

In case of any queries pertaining to e-voting members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Nitin Kunder (022-23058738) or Mr. Mehboob Lakhani (022-23058543) or Mr. Rakesh Dalvi (022-23058542).

For HEC Infra Projects Limited
Sd/-
Jeel H. Patel
Company Secretary

Date : 04/09/2020

GANESH HOUSING CORPORATION LIMITED

(CIN: L45200GJ1999PLCO5817)

Registered Office: Ganesh Corporate House, 100 Feet Hebatpur-Trailokya Road, Near Sola Bridge, Off S. G. Highway, Ahmedabad 380 054, India
Tel : +91 79 61608888 & Fax : +91 79 61608899;
Website: www.ganeshhousing.com • Email id: investors@ganeshhousing.com

NOTICE

NOTICE is hereby given that the 29th Annual General Meeting (AGM) of the Members of Ganesh Housing Corporation Limited will be held on Wednesday, 30th September, 2020 at 3:00 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of the 29th AGM of the Company. The Company has sent Annual Report along with Notice convening 29th AGM on 2nd September, 2020, through electronic mode to the members whose email addresses are registered with the Company and/or Depositories in accordance with the circular issued by the Ministry of Corporate Affairs dated 5th May, 2020 read with circulars dated 8th April, 2020 and 13th April, 2020 and Securities and Exchange Board of India circular dated 12th May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.ganeshhousing.com; website of BSE Ltd. at www.bseindia.com; website of NSE at www.nseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

NOTICE is further given pursuant to Section 91 of the Companies Act, 2013 read with Regulation 42 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 (the "LODR") that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Wednesday, 23rd September, 2020 to Tuesday, 29th September, 2020 (Both days inclusive) for the purpose of 29th AGM.

NOTICE is further hereby given pursuant to the provisions of Section 108 of Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44(4) of the LODR that the Company is providing its members facility to exercise their rights to vote by electronic means on all the resolutions proposed to be passed at the 29th AGM of the Company. The shareholders are requested to note the following information:

1. The Shareholders of the Company holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date on Wednesday, 23rd September, 2020, may cast their votes electronically for businesses as detailed in the Notice calling 29th AGM. In this regard the Company has appointed Central Depository Services (India) Limited (CDSL) for providing remote e-voting facility. The remote e-voting module will be available on the website of the Company at www.evotingindia.com. However, if the member is already registered with CDSL for e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 2. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote through remote e-voting. 3. Shareholders holding physical or demat shares whose email IDs are not registered with the Company may register the same by sending email to Company viz. investors@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Pvt. Ltd. viz. mcsaaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited); by providing following necessary details: a) For Physical sharehold: please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); b) For Demat sharehold: please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhar Card); c) For e-voting then he can use his existing login ID/ User ID and password for casting the vote